



Regd. Office : Texcellence Complex, Near. Anupam Cinema, Khokhra, Ahmedabad - 380 021, India.

Phone : 91-79-67777000 • Fax : 91-79-22773061 • E-mail : [texcellence@ashima.in](mailto:texcellence@ashima.in)

CIN No : L99999GJ1982PLC005253

15<sup>th</sup> July, 2021

To,  
**BSE Limited**  
Corporate Relationship Department,  
25<sup>th</sup> Floor, P J Towers,  
Dalal Street, Fort, Mumbai – 400001  
SECURITY CODE NO. 514286

To,  
**National Stock Exchange of India Ltd**  
Exchange Plaza 5<sup>th</sup> Floor, Plot no. C/1,  
G Block, Bandra Kurla Complex,  
Bandra (East), Mumbai – 400051  
SECURITY CODE NO. ASHIMASYN

Dear Sir,

**Sub : Newspaper Advertisement – Disclosure under Regulation 30 and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (“SEBI Listing Regulations”)**

Pursuant to Regulation 30 read with Schedule III Part A Para A and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose the copies of newspaper advertisement published in Western Times (English) and Western Times (Gujarati), in compliance with the Circular No. 20/2020 dated May 5, 2020 and Circular No. 02/2021 dated January 13, 2021 of Ministry of Corporate Affairs, intimating that 38<sup>th</sup> Annual General Meeting of the Company will be held on Tuesday, August 17, 2021 at 11.30 a.m. through Video Conferencing / Other Audio Visual Means.


The above information is also available on the website of the Company [www.ashima.in](http://www.ashima.in).

This is for your information and records.

Thanking You,

Yours Faithfully,

For Ashima Limited

  
Dipak Thaker  
Company Secretary



Encl : As above

T E X C E L L E N C E

Visit us at <http://www.ashima.in>

## NTPC to set up India's single largest solar park at Rann of Kutch

**New Delhi,** NTPC Renewable Energy Ltd, a 100% subsidiary of NTPC, has received the go-ahead from Ministry of New and Renewable Energy (MNRE) to set up 4750 MW renewable energy park at Rann of Kutch in Khavada, Gujarat. This will be India's largest solar park to be built by the largest power producer of the country.

NTPC Renewable Energy Ltd (NTPC REL), has been given the go-ahead by MNRE on 12th July 2021 under Mode 8 (Ultra Mega Renewable Energy Power Park) of Solar Park Scheme. NTPC REL has plans to generate green hydrogen on a commercial scale from this park.

As a part of its green energy portfolio augmentation, NTPC Ltd, India's largest energy integrated company aims to build 60 GW Renewable Energy Capacity by 2032. Currently, the state owned power major has an installed capacity of 66 GW across 70 power projects with an additional 18 GW under construction.

Recently, NTPC has also commissioned India's largest Floating Solar of 10 MW (ac) on the reservoir of Simhadri Thermal Power Plant, Andhra Pradesh. An additional 15 MW (ac) would be commissioned by August 2021.

Further, a 100 MW Floating Solar Project on the reservoir of Ramagundam Thermal Power Plant, Telangana is in the advanced stage of implementation.

Additionally, NTPC RE Ltd. has recently signed an MoU with UT, Ladakh and Ladakh Autonomous Hill Development Council (LAHDC) for the generation of green hydrogen and deployment on FCEV buses. The signing of the MoU was also marked with the inauguration of NTPC's first solar installations in Leh in form of solar trees and a solar car port. NTPC REL, the subsidiary was incorporated on 07.10.2020 to accelerate the RE business of NTPC.

## IDFC Mutual FundAd #DateyRaho Celebrates Those Who Stayed The Course

**Mumbai,** IDFC Mutual Fund's latest digital advert highlights the success of those who persevered even though the pandemic and the lockdown made them doubt themselves. In the first quarter of FY21, financial markets were in turmoil and most investors were worried about the state of their current investments and how they will perform in the future. The advert especially salutes the Indian investors who were resilient and disciplined in their wealth creation process and reaped rewards with positive returns for staying their course.

Highlighting the takeaway for investors,

Gaurav Parija, Head - Marketing & Sales, IDFC AMC said that, "Investors who showed patience during the tough times by not redeeming from equity markets but continuing to invest via SIP significantly benefitted and generated significant returns over the past one year. The focus of the advert is to let everyone know that while the pandemic may have made us reevaluate a lot of things in our lives, those who followed their passion and goals have managed to adapt and come out stonger and better." IDFC Mutual Fund's #DateyRaho new video - <https://www.youtube.com/watch?v=Ez4U4JcB10k>, showcases the struggles of

a budding footballer, an advisor, a teacher, a doctor and an investor during the lockdown and how by focusing on their goals, their growth path, their passion and their belief they managed to overcome their challenges and came out better off. Last year, the #DateyRaho campaign conducted by IDFC Mutual Fund (#DateyRaho (Hindi): <https://youtu.be/dEKaWjVPqN0> and #DateyRaho (English): <https://youtu.be/E6VyVNaFWgM>) encouraged investors to stay the course even when the market was volatile. Those who took heed and stayed invested benefited immensely.

## Business Brief

### Equity indices flat amid weak global cues, banking stocks fall

**Mumbai,** The Indian stock market traded on a flat-to-negative note on Wednesday morning tracking decline on the global markets.

Selling pressure was witnessed in banking and finance stocks. Around 10.25 a.m. Sensex was trading at 52,712.64, lower by 57.09 points or 0.11 per cent from its previous close of 52,769.73.

It opened at 52,801.44 and has so far touched an intra-day high of 52,801.44 and a low of 52,611.97 points.

Tech Mahindra, HCL Technologies and Sun Pharmaceutical Industries were the top gainers on the Sensex, while the major losers were HDFC, Hindustan Unilever and Maruti Suzuki India.

The Nifty50 on the National Stock Exchange was trading at 15,794.35, lower by 18.00 points or 0.11 per cent from its previous close.

Manish Hathiramani, technical analyst, Deen Dayal Investment said, "Once again the index has opened on a tepid note. The range bound movement of the Nifty is challenging and testing the patience of traders. Until we do not get past either level of this range which is currently between 15,400 and 15,900, we will not witness momentum and a one-sided trading opportunity."

### India's June WPI inflation eases on lower food prices

**New Delhi,** Lower food prices aided in sequentially lowering India's annual rate of inflation based on wholesale prices in June. However, the inflation rate alarmingly remained above the 12 per cent mark.

Accordingly, WPI rose by 12.07 per cent in June from a rise of 12.94 per cent in May. The monthly rate of inflation, in June 2020 stood at (-) 1.81 per cent.

On a sequential basis, the month over month change in WPI index for June 2021 as compared to May, was 0.75 per cent. "The high rate of inflation in June 2021 is primarily due to low base effect and rise in prices of mineral oils viz. petrol, diesel (HSD), naphtha, ATF, furnace oil etc, and manufactured products like basic metal, food products, chemical products etc as compared the corresponding month of the previous year," the Ministry of Commerce and Industry said in a statement on WPI.

The low base effect has been attributed to last year's full nationwide lockdown which was imposed to curb the spread of the Covid-19 pandemic.

## No fuel price hike for second straight day

**New Delhi,** The oil marketing companies kept the retail price of petrol and diesel unchanged on Wednesday, the second consecutive day of no change, to analyse the global oil price movement before making further revisions.

After crossing \$77 a barrel, global crude prices have softened a bit with differences surfacing in oil cartel OPEC over continuation of production cuts and demand concerns over rising Covid cases in several European countries.

With price pause on Wednesday, petrol continues to be priced at Rs 101.19 a litre and diesel at 89.72 a litre in the national capital.

On Monday, oil companies had raised the price of petrol but reduced diesel prices marginally to provide respite to the transport sector. The prices had remained unchanged on Tuesday.

Across the country as well the fuel prices re-

mained unchanged on Wednesday but the rates varied depending on the level of local taxes in states.

Starting from a price line of Rs 90.40 a litre on May 1, petrol is now priced at Rs 101.19 a litre in the national capital, rising by a sharp Rs 10.79 per litre in the last 75 days. Similarly, diesel price in the capital also rose by Rs 8.99 per litre in the past two months to reach Rs 89.72 a litre in the national capital from a level of Rs 80.73 a litre in early May.

With the price rise over past two months, fuel rates have been revised upwards in 39 out of 75 days between May, June and July up to now to take retail rates touch new highs across the country. It had remained unchanged on 36 days.

Consumers can now expect that any further rise in fuel price is checked only when OMCs start cutting the retail price of petrol and diesel over next few days to provide relief.

## Reliance Power shareholders approve preferential offer to Rlnfra with over 94% votes in favour

**New Delhi,** The shareholders of Reliance Power Limited (Reliance Power), through postal ballot, have approved with overwhelming majority, preferential issue of equity shares and warrants.

Accordingly, Reliance Power shall allot 59.50 Crore equity shares and 73 Crore warrants convertible into equivalent number of equity shares of the Company at a price of Rs.10 each by conversion of debt, aggregating upto Rs 1,325 Crore, to Reliance Infrastructure Limited (Reliance Infrastructure), a listed promoter company.

Reliance Infrastructure and other promoter group holding in Reliance Power shall increase to 24.98% and shall further increase to 38.24 per cent on conversion of warrants, benefiting 8 lakh shareholders of Reliance Infrastructure.

The shareholders of Reliance Power have also approved with overwhelming majority, the raising of funds by issue of: (i) foreign currency convertible bonds upto 50% of the then net worth of the Company, and (ii) securities through qualified institutions placement upto 25% of the then net worth of the Company.

Reliance Power Limited, a part of the Reliance Group, is India's leading private sector power generation and coal resources company. The company has one of the largest portfolios of power projects in the private sector in India, based on coal, gas and renewable energy, with an operating portfolio of 5,945 megawatts. —IANS

South Korea's ICT ministry has opened a testing facility for products that run on 5G networks in a move to support small and mid-sized companies.

The country has earmarked a total of \$13.8 million from 2019 to 2023 to develop the testing center in Gumi, about 260 kms southeast of Seoul, according to the Ministry of Science and ICT. The facility aims to support local companies in checking whether their connected devices work properly on local and global 5G networks before commercialisation, reports Yonhap news agency. While the test bed has so far established infrastructure for products that run on non-standalone 5G, which requires support from 4G LTE, the ministry said it will introduce standalone 5G infrastructure this year. South Korea telecom operators have yet to commercialize standalone 5G, which promises improved latency, though KT Corp. aims to deploy the technology soon.

**Seoul,** South Korea's ICT ministry has opened a testing facility for products that run on 5G networks in a move to support small and mid-sized companies.

The country has earmarked a total of \$13.8 million from 2019 to 2023 to develop the testing center in Gumi, about 260 kms southeast of Seoul, according to the Ministry of Science and ICT. The facility aims to support local companies in checking whether their connected devices work properly on local and global 5G networks before commercialisation, reports Yonhap news agency. While the test bed has so far established infrastructure for products that run on non-standalone 5G, which requires support from 4G LTE, the ministry said it will introduce standalone 5G infrastructure this year. South Korea telecom operators have yet to commercialize standalone 5G, which promises improved latency, though KT Corp. aims to deploy the technology soon.

**Seoul,** South Korea's ICT ministry has opened a testing facility for products that run on 5G networks in a move to support small and mid-sized companies.

The country has earmarked a total of \$13.8 million from 2019 to 2023 to develop the testing center in Gumi, about 260 kms southeast of Seoul, according to the Ministry of Science and ICT. The facility aims to support local companies in checking whether their connected devices work properly on local and global 5G networks before commercialisation, reports Yonhap news agency. While the test bed has so far established infrastructure for products that run on non-standalone 5G, which requires support from 4G LTE, the ministry said it will introduce standalone 5G infrastructure this year. South Korea telecom operators have yet to commercialize standalone 5G, which promises improved latency, though KT Corp. aims to deploy the technology soon.

## Twitter to let users change who can reply to tweets after posting

**New Delhi,** In a bid to give more power to its users, Twitter on Wednesday said it is rolling out a new feature where you can decide who can reply to your tweet after you post it, a move that will help curb harassers and abusers on the platform.

Called "Change who can reply," the feature is available in the three dots menu next to your tweet.

"Your Tweets>Your space. Now you can change who can reply to you even after you Tweet," the company said.

Currently, the users can limit who replied to your tweets, but they have to set that preference while writing the tweet.

With the new feature, the users can change who can reply to a later time.

The new feature will soon be available on iOS, Android and the web globally.

To change who can reply, click or tap the three-dot menu on a tweet and look for the option in the menu.

Earlier this month, the micro-blogging site revealed two concepts for upcoming features, including "trusted friends," that would allow users to target tweets toward specific audiences without having to switch

accounts or change privacy settings.

The first would enable people to designate "trusted friends" so some tweets would only be visible to that group.

The idea is similar to Instagram's "close friends" feature for Stories.

According to an image shared by Twitter designer Andrew Courter, Twitter's version would allow users to toggle the audience much like the way you can choose who can reply to you.

Another feature would allow people to take on different personas or "facets" from the same account.

—IANS

## India among most vulnerable nations, least ready for automation

**New Delhi,** India joins Bangladesh and Pakistan among the countries most vulnerable and least prepared for automation in the Asia-Pacific region with construction, agriculture and mining sectors being the most at-risk, a new report showed on Wednesday.

In particular, India ranks fifth highest in terms of the impact from automation and ninth in terms of their level preparedness for this impact.

The country faces a greater likelihood of being impacted by automation due to larger employment shares in agriculture, manufacturing, and construction, all identified as high-risk industries, according to report by California-based software company Autodesk.

"Automation creates opportunities for new, more meaningful types of work as it replaces mundane or repetitive manual tasks, but the state of preparedness of countries and industries will determine whether they benefit from these advances," said Rajeev Mittal, Regional Director, India & SAARC, Autodesk.

"Improving digital literacy, supporting disad-

vantaged workers, and putting in place the right infrastructure and skills will help create new roles that workers can transition into," he said in a statement.

Though India's construction sector is most likely to be automated, its construction sector is the fifth most vulnerable, ahead of Pakistan, Indonesia, Bangladesh and Myanmar and the Philippines, respectively due to these countries greater extent of disadvantage.

For agriculture, India, the Philippines and Indonesia have a higher likelihood of automation for the sector, even as Pakistan's agri-sector was at the highest risk of impact from automation.

"India's mining sector has the second-highest risk of impact from automation after Bangladesh. The sector's vulnerability to automation stems from its relatively low skill requirements, its high degree of routine and manual tasks, and use of direct physical activity to operate machinery," according to the report.

**Seoul,** South Korea's ICT ministry has opened a testing facility for products that run on 5G networks in a move to support small and mid-sized companies.

The country has earmarked a total of \$13.8 million from 2019 to 2023 to develop the testing center in Gumi, about 260 kms southeast of Seoul, according to the Ministry of Science and ICT. The facility aims to support local companies in checking whether their connected devices work properly on local and global 5G networks before commercialisation, reports Yonhap news agency. While the test bed has so far established infrastructure for products that run on non-standalone 5G, which requires support from 4G LTE, the ministry said it will introduce standalone 5G infrastructure this year. South Korea telecom operators have yet to commercialize standalone 5G, which promises improved latency, though KT Corp. aims to deploy the technology soon.

**Seoul,** South Korea's ICT ministry has opened a testing facility for products that run on 5G networks in a move to support small and mid-sized companies.

The country has earmarked a total of \$13.8 million from 2019 to 2023 to develop the testing center in Gumi, about 260 kms southeast of Seoul, according to the Ministry of Science and ICT. The facility aims to support local companies in checking whether their connected devices work properly on local and global 5G networks before commercialisation, reports Yonhap news agency. While the test bed has so far established infrastructure for products that run on non-standalone 5G, which requires support from 4G LTE, the ministry said it will introduce standalone 5G infrastructure this year. South Korea telecom operators have yet to commercialize standalone 5G, which promises improved latency, though KT Corp. aims to deploy the technology soon.

**Gujarat Water Supply & Sewerage Board**

**Tender Notice No. 05/2021-22**  
**On-line Tender I.D. :- 472256**

Tender are invited through Two Bid E-Tendering by the Executive Engineer P.H. Mech. Dn. Main water tank Compound, Old Junction Road, Surendranagar work of the Supply, Installation, Testing & Commissioning of HIMS Pump sets with Co-ordinated mechanical accessories and electrical equipments etc. with five year comprehensive operation, Maintenance and security complete at Lilapur Head Works, Tal. Lakhtar. Dist. Surendranagar Est. Amt. (25.21 Lakh) Tender Documents can be seen, Download and submitted on website, <https://www.nprocure.com>. Last date for on line bid submission Dt. 29.07.2021 up to 18.00 Hrs. Physical from latest by Dt. 30.07.2021 up to 15.00. Any additional information of the tender will be available at above mentioned office. All Right is reserved to reject any or all tenders without assigning any reasons thereof. If any Amendments it will be Published on web site. For The Problem of Drinking water in rural water supply scheme contact Tall Free No. 1916

આહિતી/સુરેન્દ્રનાગર/૧૬/૨૧-૨૨

**FORM NO. URC-2**

Advertisement giving notice about registration under Part I of Chapter XXI,

[Pursuant to section 374(b) of the companies Act, 2013 and rule 4(1) of the companies (Authorized to Register) Rules, 2014]

1. Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application has been made to the Registrar at Central Registration Centre, Indian Institute of Corporate Affairs (IICA), Plot no. 6,7,8, Sector 5, IMT Manesar, Gurgaon, Haryana, India, 122050 that **OASES TECHNOVATIONS LLP** a business entity may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares.

2. The principal objects of the company are as follows: To carry the business of process automation and integration solutions through designing, implementing, supporting and marketing software applications; software publishing, consultancy and supply [Software publishing includes production, supply and documentation of ready-made (non-customized) software], operating systems software, business & other applications software; ERP and SAS solutions; consultancy including providing the best solution in the form of custom software after analyzing the user.

3. A copy of the draft memorandum and articles of association of the proposed company may be inspected at the office at H-1010, Titanium City Centre, Nr. Sachin Tower, 100 Ft AnandNagar Road, Satellite, Ahmedabad - 380015, Gujarat, India.

4. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre, Indian Institute of Corporate Affairs (IICA), Plot no. 6,7,8, Sector 5, IMT Manesar, Gurgaon, Haryana, India, 122050, within twenty one days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

**Dated this 13th day of July, 2021**

**Name(s) of Applicant**

1. Surendra Hridayaram Varma  
2. Sarfaraz Mohammedhanif Malek

**WATER AND SANITATION MANAGEMENT ORGANIZATION**

**DISTRICT WATER AND SANITATION UNIT-KACHCHH**

Unit Manager, DWSU-WASMO, Banni Inspection Bungalow Campus, Near St. Xaviers School, Bhuj-Kachchh, Pin: 370001. Ph. 02832 226437, 226870 invites e-tenders on behalf of various VWSC of Kachchh district from eligible agencies / parties for implementation / execution of approved civil and water works e-tender I.D. No. 472258 and 472260 pertaining to in-village water supply scheme under "Augmentation in tap Connectivity in Rural Area/JMM" Programme. The last date of submission of bid for eligible bidders as per tender norms is 28.07.2021 up to 18.00 hrs. For further information the interested bidders may contact the Adyakhsh of concerned Pani Samiti as contact details given in tender NIT. All the uploaded documents are to be sent/submitted to Unit Manager, WASMO-Bhuj, Kachchh within prescribed time limit through RPAD / Speed Post only. Tender I.D. and name of work should be clearly mention on envelop. If any changes in this tender will be uploaded on-line through concerned website. The tender submitted through post/off-line will not be considered. Unit Manager and concerned Pani Samiti reserves the right to accept or reject any or all tenders without assigning any reason.

Web Site : [www.wasmo.nprocure.com](http://www.wasmo.nprocure.com)  
(DDI/KUTCH/373/2021)

**Gujarat State Road Development Corporation Ltd.**

**Ground Floor, Nirman Bhavan, Sector 10-A, Gandhinagar**

**Tender Notice (Through E-Tendering only)**

General Manager (Project) Gujarat State Road Development Corporation Ltd., (GSRDC) Ground Floor, Nirman Bhavan, Sector-10/A, Gandhinagar invites On-line Tenders. The work details are as under :

Name of work	Estimated cost (in Rs Crores)	EMD (In Rs. Lakhs)	Tender Fee (Non-refundable) (in Rs.)	Tenure (Months)
Collection of user fee through fee collecting agency on auction basis through competitive bidding on e-tender basis at Himmatnagar Bypass Road (Km.00/00 to 8700)	1.89	1.90	Tender fee 18000/- GST 3240/- = 21240/-	12

The mode of submission is through on line E-tendering on [www.gsrdc.nprocure.com](http://www.gsrdc.nprocure.com) and the schedule for E-tendering is as under. The complete tender notice details are available on [www.statenders.com](http://www.statenders.com) and [www.gsrdc.com](http://www.gsrdc.com)

Particulars	Date
Bid document downloading start date/time	19.07.2021 from 12.00 hrs
Pre Bid Meeting	28.07.2021 upto 12.30 hrs
On line submission last date/time	2-8.2021 at 17.00 hrs.
Opening of pre-qualification bid (on-line)	2.08.2021 at 17.30 hrs.

Tender fee & EMD shall be submitted in physical form by RPAD at this office Date/Time

Demand Draft for EMD Solvency Certificate and Tender Fee shall be submitted in electronic format only uploading the bid. Accordingly after of those shall be opened whose EMD solvency and tender fee is purpose of realization of EMD. Tender fee, bidder shall send the demand Draft in original to General Manager (Projects) at the time of tender opening or send the same through RPAD/Speed Post so as to reach to 9/08/2021 upto 18.00 Hrs. Penetrative action against bidder shall be initiated for not submitting demand draft in original. Exemption Certificate from paying EMD shall not be accepted in any case. EMD Tender Fee shall be uploaded and submitted in hard copy with Tender Fee as per Schedule. Any documents in supporting of bid shall be submitted in electronic format only through on-line (by scanning etc.)

**INF/623/21-22**

**Change of Name**

I have changed my old name  
**SHIVANI MITESH SINH BIHOLA**  
to new name  
**SHIVANIBA MITESH SINH BIHOLA**  
Add:Ramji Vaidal Vaidal, Post:Palaj, Dist., Gandhinagar

**NOTICE**

Therefore, we declare that we were known as **Suhag Vasudev Thakkar** but now we have changed the surname behind the name to **Suhag Vasudev Mirani**. Thus, **Suhag Vasudev Mirani and Suhag Vasudev Thakkar are one and the same person**. I will declare that with this public notice. And a public notice has been issued to prevent any misunderstanding.

**For Ashima Limited**  
**Dipak Thaker**  
Company Secretary

Place: Ahmedabad  
Date: 15.07.2021

**FEDBANK FINANCIAL SERVICES LTD.**

Having corporate office at Kankia Wall Street, A-Wing, 5th Floor, Unit No. 501,502,511,512, Andheri- Kuria Road, Chakala Andheri East, Mumbai, Maharashtra -400093

Demand Notice under Section 13(2) of the SARFESI Act, 2002

The below mentioned borrower and co-borrower (collectively referred to as "borrowers") mortgaged their immovable property (Securities) to Fedbank Financial Services Limited (hereinafter referred to as "Fedfin") and availed the loan. The said loan is classified as non-performing asset on 07.04.2021 because you have failed to pay that amount. In this connection Fedfin had issued a Demand Notice on 24/06/2021 under Section 13 (2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 to the addressee. The details are published here as an alternative service under Section 13 (2) and Rule 3 (1) of the Security Interest (Enforcement) Rules, 2002. You are requested to repay the amount mentioned in the Demand Notice and the accompanying interest within 60 days of the publication of this notice. In case of failure to do so, the signatory shall take such appropriate action under section 13 (4) and 14 of the Act on the said property to safe guard the interest of the Fedfin.

Details of loan number, borrowers, demand notice send under section 13 (2), amount requested and details of immovable property are given below.

LAN No.	Borrower/ Co-Borrower/ Mortgagor Names	Demand Notice Date	Amount
FED AHMS TL0477804 & FED AHMS TL0485154	1. M/s. Saha Y Transports (Borr ow er) 17, Krishna Vilsa Society , Opp. Cen tral W are house, Nar of Aslali High way, Vatva , Nar. ol, Ahmedabad, Guj - 41-382405. 2. Mr. Bhumi V . Chaudhary (Co-Borr ow er) Add- B-34, Pushpa Co. Op. Soc., Moni Hot el No Kancha , Nr.Tirthbhumi Socie ty, Isanpur , Ahmedabad-382443. Also atag otpur a V.as, Giy od, Gandhinag ar, Guj ar- 382321. 3. Mr. Veljibhai Gopalbhai P atel (Co-Borr ow er) Add- B-34, Pushpa Co. Op. Soc., Moni Hot el No Kancha , Nr.Tirthbhumi Socie ty, Isanpur , Ahmedabad-382443. 4. Mr. Chanchiben V eljibhai P atel Add- B-34, Pushpa Co. Op. Soc., Moni Hot el No Kancha , Nr.Tirthbhumi Socie ty, Isanpur , Ahmedabad-382443. Also as Shop No. 2, B Block, FP /55/1 58, Sur . No. 569/1 + 571+ 572+ 573+ 573/76, Shina Tr esidency , Opp. G.E.B. , Nr .Aakrut T ownshp, Nar ol, Lambha R oad, Ahmedabad- 382405.	24/06/2021	Rs.54,42,596/- Rs.10,89,428.00/-

**Schedule-A**  
Description of Property  
(Particulars of the immovable property mortgaged to FFSL)

**(Property-1)**

Tenement No. B-34 (Admeasuring about 71.06 Sq. Mtrs. & construction thereon 41.80 Sq. Mtrs.) "Push Tenement & Row House", Pushpa Co. Op. Housing Society Ltd., Situated Survey No. 404-406, TPS No. 55, FP No. 68, Mouje: Isanpur, Taluka- Maninagar, Dist. & Sub District: Ahmedabad.

That the said property is bounded as under- East - Society Road; West - Tenement No. B-51; North - Tenement No. B-35; South - Tenement No. B- 33

Owned By - Mr. Veljibhai Gopalbhai Patel  
• Mr. Bhumi V. Chaudhary

**(Property-2)**

Commercial property bearing Shop No. 17, in the scheme known as "Krishna Villsa Complex", situated at Survey No. 553, TPS No. 58, FP No. 37, Mouje: Vatva, Taluka- Dascroi, Dist. & Sub District: Ahmedabad, (Admeasuring about 91.98 Sq. Mtrs.).

That the said property is bounded as under- East - Krishna Villsa Row House; West - Public Road; North - Krishna Villsa Shop No. 18; South - Krishna Villsa Shop No. 1

Owned By - Mr. Veljibhai Gopalbhai Patel • Mr. Bhumi V. Chaudhary

The said Borrowers are prohibited under Section 13 (13) from transferring the asset/property, whether by lease, sale or otherwise without the prior written consent of Fedfin. Any person contravenes the provisions the said act shall be liable for punishment as specified in the said Act

DATE: 15/07/2021  
PLACE: Ahmedabad

**AUTHORISED OFFICER**  
Fedbank Financial Services Ltd

